



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૩/૦૫/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૨૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૯૭ કેસ કરી, ૮૬ વ્યક્તિઓને ઝડપી, ૬૫૫ લીટર દેશી દારૂ, ૧૯૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૯ બીયરટીન અને ૦૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૮ કેસ કરી ૪૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૯૨,૭૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૨૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અને પ્રોહી.૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૮૨૯/૧૯

સેટેલાઈટ : મનનભાઈ અસિતભાઈ શાહ (ઉ.વ.૨૫)(રહે,મોક્ષા રેસીડેંસી વાસણા મણીરત્નમ રો-હાઉસની બાજુમાં વાસણા) એ તા.૧૨/૦૫/૨૦૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૪/૨૦૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન સેટેલાઈટ ઇસ્કોન ચાર રસ્તા ખાતે દેવચાર્ક કોર્પોરેટ ઓફીસ ખાતે આરોપી (૧) હેમંત ઘનશ્યામદાસ (રહે.પીપળી ચોરાયા બેગુન જી.ચિતોડગઢ રાજસ્થાન) તથા તેની સાથે આવેલ અજાણ્યો ઇસમ (૨) પ્રકાશ અંબાવાજી મીણા (રહે.જોગીવાડા બારાપલ ગામ જી-ઉદેપુર રાજસ્થાન તથા તેની સાથે આવેલ અજાણ્યો ઇસમ નાઓએ ભેગામળી મનનભાઈ પાસેથી તેમની સ્કોર્પીયો કાર નંબર ડી.એલ.૦૧.એન.એ.૨૬૭૧ કિંમત રૂપિયા ૯,૦૦,૦૦૦/- મતાની તથા બીજી એક ઇનોવા કેસ્ટા ગાડી નંબર ડી.એલ.૦૧.એન.એ.૨૮૫૯ કિંમત રૂપિયા ૧૨,૯૭,૦૦૦/- મતાની પાલનપુર ભાડેથી ફેરવવા સારૂ લઈ જઈ, બંને ગાડીઓનું GPS ટેક્સ સીસ્ટમ તથા ફોન બંધ કરી, બંને ગાડીઓ પરત નહી કરી મનનભાઈ સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.ગમારા ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયો :-

સમાચાર યાદી નં.૮૩૦/૧૯

મણીનગર : કનૈયાલાલ ગોવિંદલાલ ચાંડક(મહેશ્વરી) (ઉ.વ.૪૫)(રહે. ઉમા માર્ગ ગાંધી કોલોની, જેસલમેર, જી.જેસલમેર) નાઓ પોતાની બહેન સાથે તા.૧૨/૦૫/૨૦૧૯ ના કલાક ૭/૧૫ વાગ્યાના સુમારે મણીનગર સિધ્ધી વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા થી આગળ રોડ ઉપર ફુટ લેવા નિકળેલા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૦ થી ૨૨ વર્ષના આશરાના) એ ભેગામળી કનૈયાલાલની બહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- મતાનું ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ કનૈયાલાલ ચાંડક એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આઇ.રબારી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૮૩૧/૧૯

વટવા : સોનલબહેન વા/ઓ ગોપાલભાઈ પુજારી (ઉ.વ.૩૦)(રહે.ઉત્સવ ફ્લેટ ચાર માળીયા વટવા) એ તા.૧૧/૫/૧૯ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૪/૨૦૧૯ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે સોનલબહેન એક ઓટોરીક્ષામાં બેસી સી.ટી.એમ. એક્સપ્રેસ હાઇ-વે થી વટવા પી.ડી.પંડ્યા કોલેજ રોડ શાકમાર્કેટ ખાતે આવેલ હતા. ત્યારબાદ પોતાની ટ્રોલી બેગ રીક્ષામાં જ મુકી શાક ખરીદવા સારૂ ગયેલ હતા. દરમ્યાન રીક્ષા ચાલકે સોનલબહેનની નજર ચુકવી રીક્ષામાં મુકેલ તેમની ટ્રોલી બેગ કે જેમાં સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મતાની, બે સોનાની વીંટી કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- સેમસંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/- તથા કપડા અને મેકઅપનો સામાન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૭૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૨,૦૦૦/- મતા મુકેલ હતી તે ટ્રોલી બેગ ચોરી કરી લઇ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી અમૃતાબહેન યોગેશકુમાર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૮૩૨/૧૯

શાહીબાગ : નિતાબહેન કિશનભાઈ પટણી (ઉ.વ.૨૮)(રહે.મોતીલાલ લલ્લુભાઈ ની ચાલી ગ્રીનસીટીની સામે અસારવા શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૧૨/૫/૧૯ સાંજના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.ડાભી ચલાવે છે.

રામોલ : સચીનભાઈ દશરથભાઈ પ્રજાપતી (ઉ.વ.૨૭)(રહે.દુર્ગાપાર્ક સોસાયટી ગોપી ડેરીના ઢાળ પાસે વસ્ત્રાલ) એ અગમ્ય કારણસર તા.૧૧/૫/૧૯ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મનુભાઈ વિરાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.